

Ref. : ZHL/LODR/2025/0510
Date : 14th February, 2025

To,
Corporate Relationship Department,
BSE Limited,
P.J. Towers,
Dalal Street, Fort,
Mumbai – 400 001
Maharashtra

Ref : Paper Cuttings of Published Unaudited Financial Results
for the Quarter ended 31st December, 2024
Scrip Code No.: 530665
ISIN : INE 812B01026

Dear Sirs,

We are enclosing herewith Photo Copy / Copy of two paper cutting one for the Jai Hind (Gujarati) and Business Standard (English) dated 13/02/2025 in which the Company has Published Unaudited Financial Results for the Quarter ended 31st December, 2024 to comply Regulation 47 of SEBI LODR Regulations.

Kindly acknowledge the same & oblige.

Thanking you,

Yours faithfully,
For Zenith Healthcare Limited,
MIHIR SATISHBHAI
SHAH
(Mihir Shah)
Company Secretary & Compliance Officer
Membership No. : A41922

Digitally signed by MIHIR
SATISHBHAI SHAH
Date: 2025.02.14 14:49:57 +05'30'

BEFORE THE HONBLE DISTRICT CONSUMER DISPUTES REDRESSAL COMMISSION AT THIRUSSUR
C.C. No. 374 of 2024
(Notice Under Rule 13(a) proviso)
COMPLAINANT: M/s. Carbon Diamonds Pvt. Ltd., Rep. by its Managing Director, Ummer Maniyah,
OPPOSITE PARTIES: M/s. Krishna Enterprises, Rep. By its Managing Partner, Mr. Manoj & another.
NOTICE
OPPOSITE PARTIES: To, 1. M/s. Krishna Enterprises, Mavli Ghani Patel Sali, Near Bapra Sitaram Chowk, Land Real Prime Building, Rajkot, Gujarat, Pin Code: 360 004, Rep. By its Managing Partner, Mr. Manoj;
2. Mr. Kishu, Partner, M/s. Krishna Enterprises, Mavli Ghani Patel Sali, Near Bapra Sitaram Chowk, Land Real Prime Building, Rajkot, Gujarat, Pin Code: 360 004.
Whereas the above named Complainant has preferred the above complaint for realization of money from the Opposite Parties towards the amount paid for purchase of the machinery and damages for the business loss and compensation. Notice is hereby given to you to appear in this court in person or through an Advocate duly instructed or through some one authorised by law to act for you in this case on 04-02-2025 at 11:30 A.M. in the forenoon, on or any subsequent date as directed by the Honble District Consumer Disputes Redressal Commission at Thirussur in the above matter should not be granted in favour of the Complainant. If you fail to appear on the said date or any subsequent date to which the matter may be posted as directed by the Court, without any further notice, the above matter will be dealt with, heard and decided on merits in your absence.
Given under my hand and the seal of this Court on 28-01-2025
By order of the court, District Consumer Disputes Redressal Commission at Thirussur
RAKESH. P & MAMATHA S., Advocates
Thirussur

ZENITH HEALTHCARE LIMITED
Registered Office : 504, Icon Elegance, Nr. Anandham Jain Derasar, Prahladnagar Cross Road, S.G. Road, Ahmedabad - 380015 | CIN No. : L2431GJ1994PLC023574
Tele Phone Nos. : 079 - 66168889 / 90, 40095550 | Fax No. : 079 - 66168891
E-mail : mahendrazenith@hotmail.com | Website : www.zenithhealthcare.com

UNAUDITED STANDALONE IND AS COMPLIANT FINANCIAL RESULT FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2024 (Rs. in Lacs)

Sr. No.	Particulars	Quarter ended 31/12/2024 (Unaudited)	Quarter ended 31/12/2023 (Unaudited)	9 Months ended 31/12/2024 (Unaudited)	9 Months ended 31/12/2023 (Unaudited)	Year ended 31/03/2024 (Audited)
1	Total Income from Operations	246.75	395.41	822.64	1155.39	1470.17
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	(10.78)	9.92	22.68	46.11	27.581
3	Net Profit / (Loss) for the period before tax (After Exceptional and / or extraordinary items)	(10.78)	9.92	22.68	46.11	27.58
4	Net Profit / (Loss) for the period after tax (After Exceptional and / or extraordinary items)	(29.22)	9.92	(4.27)	46.11	20.35
5	Total comprehensive Income for the period	-	-	-	-	-
6	Equity Share Capital (Face Value Rs.1/- each)	537.39	537.39	537.39	537.39	537.39
7	Reserve (excluding revaluation reserve as shown in the balance sheet of previous year)	-	-	-	-	196.39
8	Earnings Per Share (of Rs.1/- each) (for continuing and discontinuing operation) - Basic : - Diluted :	(0.05) (0.05)	0.018 0.018	(0.01) (0.01)	0.086 0.086	0.038 0.038

Notes : (1) The above is an extract of the detailed financial results for the Third Quarter ended 31st December, 2024 filed with the Stock Exchange pursuant to regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the website of the Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.zenithhealthcare.com

Place : Ahmedabad Date : 11-02-2025
Scan QR Code for Financial Results
For, Zenith Healthcare Limited
sd/- **Mahendra C. Raycha** Chairman & Managing Director DIN: 00577647

ICICI Bank
Branch Office: ICICI Bank Limited, Heritage Chambers, 2nd Floor, Near Azad Society Cross Road, Nehrunagar, Ahmedabad- 380015.

PUBLIC NOTICE-TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET
(See proviso to Rule 8(6))
Notice for sale of immovable asset(s)

E-Auction Sale Notice for the sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. This notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is' as per the brief particulars given hereunder:

Sr. No.	Name of Borrower(s)/Co-Borrower(s)/Guarantor(s) / Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price/ Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
1.	Vrajjal Harkhijibhai Patel (Borrower)/Jasuben Vrajjal Patel, Bipinbhai Vrajjal Patel (Co-Borrowers) Loan A/C No. 363505006278.	Shop No. 1, 2nd Floor, Revenue Survey No. 897, Plot No. 82, Dhrangadhara, Surendranagar-363310, Admreaning area 838 Sq. Ft.- Free Hold Property	Rs. 40,10,636/- (as on February 03, 2025)	Rs. 20,50,000/- Rs. 2,05,000/-	March 03, 2025 11:00 AM To 12:00 Noon	March 19, 2025 11:00 AM Onwards

The online auction will be conducted on the website (URL Link - https://disposalhub.com) of our auction agency M/s NexXen Solutions Private Limited. The Mortgagor(s)/Notices are given a last chance to pay the total dues with further interest by March 18, 2025 before 04:00 PM else the secured asset(s) will be sold as per schedule.
The prospective bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Limited, Heritage Chambers, 2nd Floor, Near Azad Society Cross Road, Nehrunagar, Ahmedabad- 380015 on or before March 18, 2025 by 03:00 PM. Thereafter, they have to submit their offer through the website mentioned above on or before March 18, 2025 by 04:00 PM along with the scanned image of the Bank acknowledged DD towards proof of payment of EMD. In case the prospective bidder(s) is/are unable to submit his/ her offer through the website, then the signed copy of tender documents may be submitted to ICICI Bank Limited, Heritage Chambers, 2nd Floor, Near Azad Society Cross Road, Nehrunagar, Ahmedabad- 380015 on or before March 18, 2025 by 05:00 PM. Earnest Money Deposit DD/PO should be from a Nationalised/ Scheduled Bank in favour of 'ICICI Bank Limited' payable at Ahmedabad.
For any further clarifications in terms of inspection, Terms and Conditions of the E-Auction or submission of tenders, contact ICICI Bank Employee Phone No. 7573024297.
Please note that Marketing agencies, 1. Value Trust Capital Services Private Limited, 2. Augeo Asset Management Private Limited, 3. Hecto PropTech Private Limited, 4. Girmansoft Pvt. Ltd. have also been engaged for facilitating the sale of this property. The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.
For detailed Terms and Conditions of the sale, please visit www.icicibank.com/4p4s
Date : February 13, 2025
Place : Surendranagar
Authorized Officer
ICICI Bank Limited

APPENDIX IV [Rule-8(1)]
POSSESSION NOTICE (for immovable property)

EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LIMITED
Retail Central & Regd. Office: Edelweiss House, Off CST Road, Kalina, Mumbai 400098

Whereas, That the Original Lenders have assigned the below financial assets to Edelweiss Asset Reconstruction Company Limited which is acting in its capacity as various trustees mentioned below (EARC). Pursuant to the assignment agreements, under Sec.5 of SARFAESI Act, 2002, EARC has stepped into the shoes of the Assignor and all the rights, title and interests of Assignor with respect to the financial assets along with underlying security interests, guarantees, pledges have vested in EARC in respect of the financial assistance availed by the Borrowers and EARC exercises all its rights as a secured creditor.

The Authorized officer of the EARC, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 and in exercise of powers conferred under Section 13(12) read with (Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice as mentioned below calling upon the borrower(s) to repay the amounts mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned being the Authorised Officer of Edelweiss Asset Reconstruction Company Limited has taken possession of the properties described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 6 of the Security Interest (Enforcement) Rules, 2002 on the date mentioned against each property.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Edelweiss Asset Reconstruction Company Limited for the amount mentioned below and interest thereon.

Name of Assignor	Name of Trust	Loan A/C Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
HDB Financial Services Ltd.	EARC TRUST SC-483	1539912	1) M/S. Jay Kuber Earthmovers A Proprietorship Firm Through Its Proprietor Mr. Rakeshkumar G Dubey (Borrower) 2) Mrs. Pritiben Rakeshbhai Dubey, 3) Mr. Rakesh Gyaneshwar Dubey (Co-borrower)	Rs. 27,45,025.69/- as on 08/07/2024 & 11/07/2024	08/02/2025	Physical Possession

Description of Secured Asset - All That Piece And Parcel of Immovable Property Being Flat No. 203 & 204, 2nd Floor, Shree Nathji Apartment, Building - A, B/S Mahavirham Raghuvir Chowdk, Utran- Kosad Road, Amroli, Surat 394 107 And Said Property Situated At Flat No. 203 & 204 On The 2nd Floor, Admeasuring 82.82 Sq. Mts., Super Built Up Area, Along With 20.31 Sq. Mts., Undivided Share In The Land of "SHRINATHJI APARTMENT", Building No. "A", Situated At Revenue Survey No. 554/2-3, Block No. 989, T.P. Scheme No.70, Final Plot No.282, of Moje: Kosad, Ta: Surat City Dist.: Surat. Bounded As Under: East By: Flat No.205, West By: Road, North By: Road, South By: Flat No. 202.

Name of Assignor	Name of Trust	Loan A/C Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
HDB Financial Services Ltd.	EARC Trust SC-483	3461169	(1) Mr. Raju Naresh Dornala (Borrower) (2) Mrs. Sopan Raju Dornala (Co-borrower)	Rs. 24,19,833.91/- as on 20/08/2024 & 21/08/2024	08/02/2025	Physical Possession

Description of Secured Asset - All The Piece And Parcel of Immovable Residential Property Being Flat No. C-201, Shyam Height Apt., Mansarovar Road, Sandipani School, Godadara, Surat 395 010 And Said Property Situated At No. 201, On 2nd Floor, Built Up Area Admeasuring 504.72 Sq. Feet., I. E. 46.88 Sq. Mts. In "SHYAM HEIGHTS", of Building C, Situated At Revenue Survey No. 78/1 II Block No. 83, Area Admeasuring 9105 Sq. Mts, Its T.P. Scheme No. 89, F.P. No. 16/A, 16/B/L, 16/B/2 Paiki Final Plot No. 16/B/2, Area Admeasuring Its Final Plot Area Admeasuring 1591 Sq. Mts, And R.S. No. 80 Its Block No. 84/B/365, Area Admeasuring 1600 Sq. Mts, Its T.P. Scheme No. 89, F.P. No. 17/B, Area Admeasuring 1256 Sq. Mts, Totally Final Plot Area Admeasuring 2847 Sq. Mts, of Moje: Godadara, Sub District: Udhana, Dist.: Surat. Bounded As Under: East By: Flat No. C-202, West By: Margin, North By: Margin, South By: Passage.

Name of Assignor	Name of Trust	Loan A/C Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
M/s. Poonawalla Housing Finance Ltd.	EARC Trust SC-492	HM/0190 /H/17/10 0674	1) Mr. Kiran Gokul Hire (Borrower) 2) Mrs. Yumnabai Gokul Hire (Co-borrower)	Rs. 11,65,617.51/- as on 26/06/2024 & 26/06/2024	09/02/2025	Physical Possession

Description of Secured Asset - All Part & Parcel of Residential Property (secured Assets) Being Flat No.319 Having Built Up Area Adm. 28.82 Sq. Mtrs. (Super Built Up Area Adm. 52.04sq. Mtrs.) And Land Area Adm. 9.04 Sq. Mtrs. Undivided Share of Common Land Situated On The 3rd Floor of Building Known As "Shiv Palaces" of Area Known As "Aradhna Green Land Part - 2" of Plot No. 43 To 58 of Block No.249,250,254 After Amalgamation New Block No. 249 Located At Village: Jolva, Sub. Dist.: Palsana, Dist.: Surat In The State of Gujarat. Boundaries of The Aforesaid Property: North- Property of Plot No. 428&9, South- Society Road, East- Society Road, West- Society Road

Name of Assignor	Name of Trust	Loan A/C Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
M/s Cholamandalam Investments & Finance Company Limited	EARC TRUST SC-481	XOHLAME00 001525317 & XOHLAME00 001525276	1) Mr. Dineshbhai Parshotambhai Bhuvu (Borrower), 2) Pallaviben Dineshbhai Bhuvu (Co-Borrower)	Rs. 26,38,865.88 as on 21/11/2023 & 28/11/2023	09/02/2025	Physical Possession

Description of Secured Asset - Property 1: All the piece and parcel of the immovable property bearing Flat No.11, on 1st Floor, Block No. A/1, Vraj Vallabhprasa Co. Op. Housing Society Ltd., Survey No.652,519 & 516 TPS No.30, FP No.6, Mouje:Asana, Taluka:Asava, Dist & Sub Dist: Ahmedabad & Bounded as: By North : Open Margin, By South : Passage, By East : Open Margin, By West : Common Wall of F.No.A/1/12

Description of Secured Asset - Property 2: All the piece and parcel of the immovable property bearing Flat No.12, on 1st Floor, Block No. A/1, Vraj Vallabhprasa Co. Op. Housing Society Ltd., Survey No.652,519 & 516 TPS No.30, FP No.6, Mouje:Asana, Taluka:Asava, Dist & Sub Dist: Ahmedabad & Bounded as: By North : Open Margin, By South : Parly Passage & Parly Common Wall of F. West Open Margin No.A/1/13, By East : Common Wall of F. No.A/1/11, By West : Open Margin

Name of Assignor	Name of Trust	Loan A/C Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
M/s Cholamandalam Investments & Finance Company Limited	EARC TRUST SC-481	XOHLAM E000023 57980	1) Mr. Ranjvas Purusarm Patel (Borrower), 2) Savita Ranjvas Patel (Co-Borrower)	Rs. 23,86,568/46 as on 07/12/2023 & 11/12/2023	09/02/2025	Physical Possession

Description of Secured Asset - All the piece and parcel of the Mortgage Property Flat No. A/304, on 3rd Floor, "Sarthi Apartment" Nr. PF High School, Vithalagar Tekra, Ghosar, Ahmedabad-380050 and said property situated, at Flat No. A/304, on 3rd Floor, "Sarthi Apartment". Survey no.40 to 43+169+172/112. TPS No.64, ADM as mentioned 82.70 Sq. Mtrs., Mouje Ghodasra, Taluka. Maninagar, Dist & Sub Dist: Ahmedabad & Bounded as: By North : 9 MTRS Public Road, By South : Balkrushna Colony, By East : Shree Krishna Raw House, By West : House of Sagrambhai Bharwad

Name of Assignor	Name of Trust	Loan A/C Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
Poonawalla Housing Finance Ltd	EARC TRUST SC-492	HL/0214/ H/17/100 162	1) Kallashkumar Maheshwari (Borrower), 2) Mohini Devi (Co-Borrower)	Rs. 14,87,197.38 as on 24/06/2024 & 26/06/2024	08/02/2025	Physical Possession

Description of Secured Asset - All the piece and parcel of immovable property being plot No.75 paiki north side RS No. 184/paiki/2/sudarshan Residency B/H GEB Office Nr Dhanera Tharad Road At Dhanera Dist: Banaskantha Palanpur 385310 and said property situated at n/a agriculture property residential plot out of revenue survey no. 184 paiki 2/paiki 2, plot no.75 paiki north side, total admeasuring 47-035 sq. meter, 50-289 sq. fts. i. a situated at "Sudarshan Residency" in the sim of Dhanera, Ta: Dhanera, Dist: Banaskantha, State: Gujarat and bounded as follows: East - Road is Situated, West- Plot No. 82 is Situated, North- Plot No. 76 is Situated, South - Remaining land of plot No. 75 Paiki is Situated

Name of Assignor	Name of Trust	Loan A/C Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
M/s. HDB Financial Services Ltd	EARC TRUST SC-483	9014088 & 14177 136	1) M/s. Shreeji Automobiles A Proprietorship Firm Through It's Proprietor Mr. Ashwinkumar Somaji Gelot (Borrower), 2) Mr. Ashwinkumar Somaji Gelot ("Co-Borrower"), (3) Mr. Somaji Amedaji Gelot ("Co-Borrower") and (4) Mrs. Gelot Champaben Somaji ("Co-Borrower")	Rs. 24,75,181.67/- as on 08/05/2024 & 10/05/2024	08/02/2025	Physical Possession

Description of Secured Asset - All that part and parcel of immovable commercial property being Unit No. 2 Plot No. 6 Shop No. 4 & 5 (2nd Floor) Shiv Complex, R.T.O Chokdi, Akhol Char Rasta, Tharad Road, Deesa, Banaskantha: 385535 and said property situated at the Akhol (Moti) N.A.R.S.No. 7/2 paiki 14648.00 sq. mtrs. land paiki admeasuring 1972.00 sq. mtrs. land paiki Division "B" paiki Plot No. 6 paiki Constructed Shopping building paiki Second Floor Shop No. 4. admeasuring 18.27 sq. mtrs. and shop no. 5 admeasuring 18.27 sq. mtrs. total 36.54 sq. mtrs. At Akhol (Moti) Ta: Deesa District: Banaskantha and bounded as under: East - Open Passage West- Division "B" paiki Plot No. 5, North- Shop No. 2 & 3, South- Shop No. 6

Name of Assignor	Name of Trust	Loan A/C Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
HDB Financial Services Ltd	EARC TRUST SC-483	4822499	1) Rajesh Auto Parts A Proprietorship Firm Through its proprietor Mr. Rajeshkumar Bhikhailal Panchal (Borrower), 2) Rajeshkumar Bhikhailal Panchal ("Co-Borrower") and 3) Varshaben Rajubhai Panchal ("Co-Borrower")	Rs. 31,99,912.75 as on 11/06/2024 & 13/06/2024	08/02/2025	Physical Possession

Description of Secured Asset - All piece and parcel of the immovable property being Sheet No. 40, CS. No. 379 paiki, Ambica Nagar, plot no.85 paiki west side, Nr. Dimpal Talikz, Chandralok Road, Al Nava Deesa, Ta. Deesa, Dist: Banaskantha-385535 And said property situated at residential house out of sheet No. 40, City Survey no. 379 paiki, plot no. 85 paiki west side, total admeasuring 58-81 sq. mtrs in the sim of Deesa, Ta: Deesa, Dist: Banaskantha State: Gujarat and boundaries as follows: East - House of Modi Dineshbhai, West - Internal Road & Then House Of Soni Kantilal, North - Internal Road, South - House of Chauhan Dineshbhai

Date : 13-02-2025
Place : Gujarat
Authorized Officer
Edelweiss Asset Reconstruction Company Limited

SALE NOTICE FOR SALE OF MOVABLE/IMMOVABLE PROPERTIES
"APPENDIX-IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]"
ZONAL STRESS ASSETS RECOVERY BRANCH, BARODA 4th Floor, Suraj Plaza Building - III, Sayajiganj, Baroda-390005 Ph.0265-2360022

E-Auction Sale Notice for Sale of Movable/Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s), Mortgagor (s) and Guarantor (s) that the below described Movable/ immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" and "without Recourse" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower (s)/ Mortgagor / Guarantor/ Secured Asset/s/ Dues/ Reserve Price/ E-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below -

Date of E-Auction : 06-03-2025 Time of E-Auction : 02:00 PM to 06:00PM

Sr./ Lot No.	Name & Address of Borrower/s/Mortgagor	Description of the Movable / immovable property with known encumbrances, if any STATUS OF POSSESSION: PHYSICAL	Total Dues.	1. Reserve Price 2. Earnest Money (EMD) 3. Bid Increase Amount.	Property Inspection date & Time
1	M/s. Rang Enterprise C/103, Param Paradise B/h Rameshwar School, Gori, Vadodara. Proprietor: Mr. Tejas Mahendrabhai Bhatt Guarantor: 1. Mrs. Nanki Kaur Pratapsingh Mahera 2. Mr. Manilal Mohanbhai Rana 3. Mr. Tejas Mahendrabhai Bhatt	All that part & Parcel of the immovable property being Sub Plot No. B-7, Jay Ambe Society, R.S.No.324/2, Plot Adm. 1087.00 Sq. Ft. Common plot and Road Adm. 784.67 Sq. Ft. Total Adm.1831.67 Sq.Ft. at Moje Village Undera Vadodara and bounded by East: 7.50 Meters Society Road; West: Margin I R.S. No. 324 paiki; North: Sub Plot No. B-6; South: Margin I and Sub Plot No. B-8 Owned by: Mr. Ashok Manilal Rana, Ajay Manilal Rana & Mrs. Bhisali Manilal Rana (All legal Heirs of Deceased Guarantor & Mortgagor Late Mr. Manilal Mohanbhai Rana). Property Id: BARB581520230021	Rs. 1,57,08,373.01/- (Rupee One Crore Fifty-Seven Lakh Eight Thousand Three Hundred Seventy-Three Paise one only) as on 30-06-2022 with further interest thereon as mentioned in the notice, till the date of payment and incidental expenses, costs, charges incurred / to be incurred less recovery.	1. Rs 25,87,000/- 2. Rs 2,58,700/- 3. Rs 20,000/-	21-02-2025 03.00 PM to 05.00 PM

For detailed terms and conditions of sale, please refer/visit to the website link <https://www.bankofbaroda.in/e-auction.htm> and online auction portal <https://baanknet.com/> Also, prospective bidders may contact the Authorized officer on Mobile No.879737578

Date : 12-02-2025, Place : Vadodara
Sd/-Authorized Officer ZOSARB, Baroda

shri dinesh mills ltd.
CIN: L17110GJ1935PLC000494
Registered Office : Near Indiabulls Mega Mall, Akota Road, Vadodara - 390 020.
Tel No. 0265 - 2960060 / 61 / 62 / 63 / 64 Email: sajitra@dineshmills.com Website: www.dineshmills.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS (STANDALONE & CONSOLIDATED) FOR THE QUARTER & NINE MONTHS ENDED 31ST DECEMBER, 2024. (Rs. In Lakhs)

Sr. No.	Particulars	STANDALONE			CONSOLIDATED								
		Quarter Ended		Year Ended	Quarter Ended		Year Ended						
		(Un-audited)	(Un-audited)	(Audited)	(Un-audited)	(Un-audited)	(Audited)						
1	Total Income from Operations	1,800.51	1,862.58	2,039.58	5,506.54	5,658.47	7,908.08	1,807.09	1,844.39	2,047.78	5,523.97	5,686.57	7,925.86
2	Net Profit / (Loss) for the period (before tax and Exceptional items)	232.69	412.39	638.73	1,126.29	1,618.53	2,066.18	239.69	393.32	643.17	1,128.02	1,629.98	2,069.85
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	11.67	412.39	4,896.06	905.27	6,383.21	6,151.25	247.31	418.69	4,918.15	1,174.20	6,448.20	6,905.44
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	(82.18)	339.96	3,970.24	639.27	5,098.48	4,790.07	153.46	346.26	3,992.33	908.20	5,163.47	5,544.25
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-	-	-	-	-	-	(87.30)	(154.70)	(234.17)	(386.34)	(680.36)	(881.62)
6	Equity Share Capital	560.06	560.06	560.06	560.06	560.06	560.06	560.06	560.06	560.06	560.06	560.06	560.06
7	Earning per share (EPS) of Rs. 10/- each												
	Basic & Diluted EPS after Exceptional Items (in Rs.)	(1.47)	6.07	70.89	11.41	91.03	85.53	1.18	3.42	67.10	9.32	80.05	83.25
	Basic & Diluted EPS before Exceptional Items (in Rs.)	(1.47)	6.07	9.60	11.41	23.10	12.59	1.18	3.42	5.82	9.32	10.60	15.19

Note : The above is an extract of the detailed format of quarter & nine months ended financial results filed with BSE Ltd. under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. These financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 11th February, 2025 are available on the BSE website www.bseindia.com and also on the Company's website www.dineshmills.com (QR Code is given hereunder).

For and on behalf of the Board of Directors,
Sd/-
Bharat Patel
Chairman & Managing Director
DIN : 00039543

यूनियन बैंक Union Bank of India
3rd Floor, Milestone building, Zanzard Road, Zanzard Chowki, Junagadh - 362001
Ph. : 0285 2990183, E Mail: cb883arec@unionbankofindia.bank

E - AUCTION SALE NOTICE
(For sale of Immovable Property)

E Auction Sale Notice for Sale of Movable/Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with provision to Rule 6(2) or 8(6) of Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrowers and Guarantors, that the below described movable/immovable property mortgaged / charged to Union Bank Of India (secured creditor), possession of which has been taken by the Authorized Officers of Union Bank of India, will be sold on "AS IS WHERE IS", " AS IS WHAT IS", and "WHATEVER THERE IS" basis , for recovery of respective dues mentioned hereunder against the secured assets mortgaged/charged to Union Bank of India, from respective borrower(s) and guarantor(s). The reserve price and earnest money deposit is shown there against each secured asset. The sale will be done by the undersigned through e-auction platform provided here under :

Sr. No.	Branch Name & Name of the Borrower / Co-Obligor / Guarantor / Mortgagor & Amount Outstanding	Description of the Property	Reserve Price/ EMD/ Bid increase amount in Rs	Possession	Account details for depositing EMD : A/c No. & IFSC CODE
01					

